

To,

MANGALAM SEEDS LIMITED

202, SAMPADA, B/H. TULSI COMPLEX, MITHAKHALI'S SIX ROADS, NAVRANGPURA, AHMEDABAD-380 009. (GUJARAT) PH.: 079-26447302, 26447598 • www.mangalamseeds.com CNI :- L01112GJ2011PLC067128

Ref No. :

Date :

Date: 12/11/2019

Bombay Stock Exchange Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001

Subject – Newspaper Advertisement of Board Meeting Notice

Ref: Scrip ID – MSL

Scrip Code: 539275

Dear Sir/Madam,

With the captioned subject, this is to inform you that the Notice of the Meeting of Board of Directors of the Company is published in Newspaper.

The scan copy of same is enclosed here.

Kindly take the same on your record and acknowledge the same.

Yours faithfully,

For Mangalam Seed Dig **Rujavi** Chalishaja Company Secretary and Compliance Officer

પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્રેકે, હાઇકોર્ટે આ ફરિયાદની તપાસ સ્ટે કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સમગ્ર ચક્રચારભર્યા કૌભાંડમાં આ સમગ્ર ચક્રચારભર્યા કૌભાંડ કોર્ય કોર્ય કોર્ય સ્ટે કોર્ય આ સમગ્ર ચક્રચાર આ સમગ્ર ચક્રચારભર્યા કોર્ય સાર આ સમગ્ર ચક્રચારભર્યા કોર્ય કોર કોર્ય કોર કોર્ય કોર્ય કોર્ય કોર્ય કોર કોર્ય કોર્ય કોર્ય કોર કોર કોર્ય કોર્ય કોર્

મંગલમ સીફસ લિમિટેડ રગુ. ઓફીસ : ૨૦૨, સંપદા કોમ્પલેશ, તુલરી કોમ્પલેશની પાછળ, મીઠાખળ MANGALAM છ શ્રેલા, નવરંગપુરા, અમદાવાદ-૯. CIN: L01112GJ2011PLC067128 નોટીસ ાર્ગિ તે ક્યોરીટીઝ એન્ડ એશ્યેન્જ બોર્ડ એફ ઇંડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ કિસ્કલોઝર રીકવારમેન્ટ્સ) નિયમે, ૨૦૧૮ ના નિયમ રહને નિયમ ૪૫ સાથે વાંચીને અર્દી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ એફ ડિસેક્ટર્સ ની બેઠક ગુરૂવાર ૧૪ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે અન્ય બાબતોની સાથે સાથે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળાના કંપનીના (અભાયદા અને સંયુક્ત) અનઓડીટેડ નાણાકીય પરિણામોની વિયારણા અને મંજુરી માટે બિધારિત થયેલ છે. આ માહિતી કંપનીની વેબસાઇટ એટલે કે www.mangalamseeds.com અને સ્ટોક એક્ચેન્જની વેબસાઇટ જેમાં કંપનીના શેર લીસ્ટેક છે એટલે કે BSE Limited અસ્થિવજના વબસાઇટ જેના કપનાના રાટ લાટક છે ખાટલ કે છે છે. આ ગામ કપ્લે (<u>www.bseindia.com)</u> પર પણ ઉપલબ્ધ છે. મંગલમ સીફસ લિમિટેક વતી, સંદી/-સ્થળ : અમદાવાદ રૂપવી થાલીસક્રમાર તારીખ : ૧૧.૧૧.૨૨.૨૦૧૯ કંપની સેકેટરી અને કપ્લાયન્સ ઓફિસર સ્થળ : અમદાવાદ તારીખ : ૧૧.૧૧.૨૦૧૯ ગુજરાત રાજ્ય વકરૂ ભોર્ડ ડો. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૮, ગાંધીનગર. જાહેર નોટીસ : આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબડીસ્ટ્રીક્ટ અમદાવાદ તાલુકા સીટી મોજે ગામ રખિયાલ સીમનાં સર્વે નં. ૨૮૧-બ-૧ મ્યુ. સેસન્સ નં. ૪૨/૧ ટીપી સ્ક્રીમ નં. ૧૦, ૨૪ ચો.વાર જમીનમાં ૨૮૧-બ-૧ મ્યુ. સંસત્સ ન. ૪૨/૧ ટોપા સ્કામ ન. ૧૦, ૨૪ ચા વાર જમાનમા બાંધકામ કરી તેમાં સીદીકી મસ્જીદનું બાંધકામ કરવામાં આવેલ તે સીદીકી મસ્જીદ ગુજરાત રાજ્ય વકક-બોર્ડ અધિનિયમ ૧૯૯૫ની કલમ-૩૬ મુજબ વકકના મુતવલ્લી સીદીકી વકક ઠેકાણું : રખિયાલ, જિલ્લો- અમદાવાદનાઓએ મજકુર વકકના ઉદેશો પુર્ણ કરવાના હેતુ માટે નીચે જણાવેલ સ્થાવર મિલ્કત વકક અદિનિયમ ૧૯૯૫ની કલમ-૩૬ હેઠળ નોંધણી કરાવા માટે નિયત નમુનામાં દરખાસ્ત કરેલ છે. જે મિલ્કતની વિગત નીચે મુજબ છે. જિલ્લો અને તાલુકો ગામ/મુ. મિલ્કતનો પ્રકાર સર્વે નં. ચો.વાર તા. અમદાવાદ, જી. અમદાવાદ મુ.પો. અમદાવાદ મસ્જીદ (રખિયાલ) 269-04-9. 28 14. 2. 4. 4. 82/9 ઉडन જણाવેલ स्थावर मिल्डन वडड अधिनियम १८८५मी डलम उह अन्वये

નોંધલીની દરખાસ્ત ગુજરાત રાજ્ય વક્ક બોર્ડ, ગાંધીનગરની વિચારણા હેઠળ હોઇ આ સંબંધે કોઇ વ્યક્તિ કે સંસ્થાના વાંધા સૂચનો ,હોય તો તે દિન-૭માં ગુજરાત રાજ્ય વક્ક બોર્ડ, ગાંધીનગરની કચેરીને મળી જાય તે રીતે લેખીતમાં આપવા જણાવવામાં આવે છે. જો કોઇ વાંધા સૂચનો કે રજૂઆત જણાવેલ સમયે મર્યાદામાં બોર્ડની કચેરીમાં નહી મળે તો ઉક્ત જણાવેલ વકફના વક્ક અધિનિયમ ૧૯૯૫ની કલમ ૩૬ હેઠળ નોંધણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમદાવાદ તા. ૧૨-૧૧-૨૦૧૯

મારી મારફત : શોએબ અલી એમ. અન્સારી, એમ.એચ. શેખ (એડવોકેટ)

જાહેર નોટીસ

આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-પ (નારોલ)ના વટવા તાલુકાના મોજે ગામ વટવાની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નં. ૧૧૨૫ પૈકી, ટી.પી.સ્કીમ નં. ૮૭ની જમીન ઉપર આવેલ ''ડાકારનાથ કો. ઓ. હા. સા. લિમીટેડ''માં આવેલ ટેનામેન્ટ નં.૧૪, વાળી મિલ્કત એંગું ટાઇટલ ક્લીયરન્સ સર્ટિકિટની માંગણી અમારા અસીલે અમારી પાસે કરેલ છે. વધુમાં તે મિલ્કત/ જમીન અંગે સોસાયટી દ્વારા આપવામાં આવેલ અસલ શેર સર્ટીફીકેટ નં. ૨૯ તા. ૨૩-૧૧-૧૯૭૨ ખોવાઇ ગયેલ હોઇ તે મિલ્કત કે તેના કોઇ ભાગ ઉપર મિલ્કતના માલિક સિવાય કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, સંબંધ, લાગભાગ, ભાગીદારી, દાવો, અલાખો, બોજો,ગીરો, લીયન, ચાર્જ હોય કે અન્ય હક્ક જમ કે લીઝ, લાયસન્સ, કબ્જો, ભોગવટો, બાનાખત, ભરણપોયણ, રહેલાંકનાં કે ઉપલયેન્ટ કેઅન્ય કોઇપણ પ્રકારનો હક્ક પોયાનો હોય તો તેઓએ તે અંગની જાલ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં દસ્તાવેજી પુરાવા સતિન લખિતમાં અમોને રજીસ્ટર્ડ પોસ્ટથી નીચે દશાવેલ સરનામે જાણ કરવી જો તમ કરવામાં નહી આવે તો સદર મિલ્કત કે તેની કોઇપણ ભાગ પરત્વે અન્ય કોઇનો કોઇ જ હક્ક, હિત, હિસ્સો, સંબંધ, લાગભાગ, બાળી બા વા વા સહેર કર લી જો તમ કરવામાં નહી આવે તો સદર મિલ્કત કે તેના

האנו הגיר ביי בי בי בי בי הובש לאארא

સ્થાનિક સમાચાર

1-28	80	ન. ૬–૧, ભારાયા વાસ,	lat and	24.000	State March	સુવર્ભના ગારા કરના	
અંક્લેશર	દિલિપસુમાર ચાદવ	518.85 E0.08E	A CONTRACTOR OF A CONTRACTOR OFTA CONTRACTOR O	३ /- ४५,०००/-	ડીસીબી બેંક લિમિટેડ, અંકલેશર વાગ્ય.	આથી બાકીદાર મિલકત સાથે કોઈપણ	
	મિલ્કતનું સરનામું : પ્લોટ નં. ૧૧૦, પ્રતિસ્કા રેસોડેન્સી, કપોદ્રા, અંકલેશ્વર બર્ગે - આવ્યુ એપ				अनमोव प्लाया, स्टेशन रोड,	અથવા કરાવ્યા હશે ત	
	<u>દર્શ</u> નદ્ર આર. જોયો પર દરકે.ફીટ ३ /- ४,५०,०००/- ३ /- ४५,०००/- મિલ્કતનું સરબામું : સ્ટર સાંઈ દર્શન રેસીડેન્સી, એન.એચ. નં. ૮, પાનીલી, અંક્લેશ્વર				જી.આઇ.ડી.સી. બસ સ્ટેન્ડ સામે, અંકલેશ્વાર, ગુજરાત - ૩૯૩૦૦૨	અથવા કરાવ્યા હશ (અંકે રૂા. ચોર્ચાસી ક	
1		the second se		. Tr. 12 1		. ૨૮/૦૨/૨૦૧૬ સુધી +	
slerri		અમૃતવાલ નાદીચાપરા ૬૨૮.૬૦ સ્કે.ફીટ 🧵 /- ૧૨,૦૨,૪૦૦/- ૨ /- ૧,૨૦,૨૪૦/- સરનામું : બાલાજી કોપલેક્ષ, રહેટ નં. ૪, ૩ ક્લોર, બાલાજી કોલડ્રીક્સનો ઉપર, મોચી ભભર મેઇન કેશરી પુલ કોર્નર, રાજકોટ, વા. અને જી. રાજકોટ, ગુજરાવ					
	אפווקאוז פנושלאשל בואב	પ્રય.ય સ્ક્રે.મી.	\$ /- \$,30,000/-	3 /- \$3,000/-	AT DUSINEY FILSE	પેગાસસ કોમર્શિ	
mils	મિલ્કતનું સરનામું : બ્લોક નં. દુરૂ, પ્લોર શો–રૂમ ની પાછળ, બિલેશ્વર સોસાયટી પ અને સીટી પાલનપૂર		ડીસીબી બેંક લિમિટેડ, સનમાન કોમ્પલેશ, સિવીલ	આવેલી ઓફિસ નં.' સિટી(વેસ્ટ) રજિસ્ટ્રે: અને ૩૨ જેનો ટી.પી			
	રાજેશતુમાર વી. કલ્કર દ્રર.કર સ્કે.મી. રૂ /- ૧૩,૭૫,૦૦૦/- રૂ /- ૧,૩૭,૫૦૦/-				- કોર્ટની સામે, સિધ્ધપૂર, ગુજરાત – ૩૮૪૧૫૧	' દિશ્વત છે. તેના માલિક	
19.51	મિલ્કતનું સરનામું : ટેનામેન્ટ નં. ૫૧, ૧	ય અંબે રેસીડેન્ટી, સર	14 18 39	લારીખ : ૦૯/૧૧/૨૦			
-	15191 KINI	.56.55 0.06		ગાગગતહે : ગાગર			
	મિલ્કતનું સરનામું : જી-૧, ગુરૂકૃપા કોમ	લેક્ષ, સુરભી ઇન્ડસ્ટ્રીસ	ક એસ્ટેટની પાસે જોલવા,	સુરત	The second second	1	
	તકામકા વાકાણે હકાણે	. 512. 208	3 /- 90,00,000/-	3 /- 9,00,000/-			
	મિલ્કતનું સરનામું : ૧૧૫, નુતન નગર : સુરત – ૩૯૫૦૦૭	ક, અર્જુન પાર્કની સામે,	s F the Delay				
	નરેશકુમાર રમણવાલ પટેલ	304.84 23.98.	3 /- 3,50,000/-	3 /- 35,000/-	PERSONAL SALVAN		
	મિલ્કતનું સરનામું : ૨૧૦, પ્રમુખ પેલેસ, પલસાશા, સુસ્ત	અંડર મેઘા પ્લાઝા સોસા	યટી, પલસાણા ચોકડીની	પાસે, કેનાલ રોડ,			
	કમલાકાંત સાર. તિવારી	પકર સ્કે.ફીટ.	3 /- 3,50,000/-	₹ /- 3€,000/-			
	મિલ્કતનું સરનાગું : ક્લેટ નં. ૪૦૪, ચોન ની પાછળ, કડોદરા બારડોલી રોડ, સુર		સી, જંચ માતાદી આર્ટસ	એન્ડ ક્રિએટસ પ્રા.વિ		WE	
	જચરાલ મનિષકુમાર સુભેન્દરસિંહ	ર૩૨ સ્કે.ફીટ.	3 /- 2,24,000/-	\$ 1- 22,400/-	State Barry Direct		
å≤α	મિલ્કતનું સરનામું : ઝુ–૧ ગ્રાઉન્ડ ફલોર, ઝુ. સુરવ	1.30					
	ગીરીશભાઇ જુવાનસિંહ બારીયા	મક્ટ.કર સ્કે.ફીટ.	3 /- 6,94,000/-	₹ /- €€,400/-	aus huithin Gent		
	મિલ્કતનું સરનામું : ક્લેટ ૨૦૧૨, મલીબ સુરત – ૩૯૪૧૮૦	ા કોમ્પલેક્ષ, ગોલ્ડન પ્લા	ડીસીબી બેંક લિમિટેડ.	Extract of Unaudite			
	સુનિલકુમાર મામસંદ				સુરત ઉદ્યના વાન્ય, સ્વિત-	-	
	મિલ્કતનું સરનાતું : ફ્લેટ નં. ગી–૨૦૨ આશિયાંદ પોઇન્ટ છાંડર પારેખ એસ્ટેટ, સક્ષોગ કોટેલની સામે, કડોદરા બારડોકી રોડ, તાર્તીવિશ્વા, પલસાણા, સુરત – ૩૬૪૩૦૫			જી–૧, સાને જી–૨, ગ્રાઉન્ડ ફલોર, રોકફોર્ડ બિઝનેશ સેન્ટર ઉદ્યના દરવાળા,	Perticulars		
	अगलम इड्राकाल्डी हिताल	રકદ્ર સ્કે.ફીટ.	3 /- 2,80,000/		र्शेंग रोड, सुरत - उत्पठ०२		
	મિલ્કતનું સરનામું : ફ્લેટ નં. ૩૦૨, ત્રીષો માળ, રવસ્તીક રેસીડેન્સી અંડર સોનીપાર્ક ૨, જત માતાદી આર્ટસ એન્ડ ક્રિએટસ પ્રા.શિ. ની બાલૂમાં, કડોદરા બારડોહી રોડ, સુરત – ૩૯૪૩૨૭ મોહનસુમાર બુચી પોર્ડ – ૩૯૩ સ્કે.ફીટ. ૨ /- ૪,૫૦,૦૦૦/– ૨ /- ૪૫,૦૦૦/–				en in linn al es	Total income from opera	
						Net Profit / (Loss) for the Extraordinary items)	
	મિલ્કતનું સરનામું : ૪૦૨, સુકુન રેંસીડેન્સી-૩ ઝાંડર સોની પાર્ક સોસાયટી, વયા માતાદી આર્ટની બાવૃમાં, એસાર પેટ્રોલ પંપની સામે, તાતીયથા, પલસાણા, સુસ્ત – ૩૯૪૩૨૫						
	દાસ દિનેશ કેવો	-\000, ૫૪ -\ ફ -\000, ૦૫, ૪ -\ ફ ડફિ. કેક ૦૬.૫૩૨ લિંગ કાંગ		₹ /- ४4,000/-		Net Profit / (Loss) for th Extraordinary items)	
-	મિલ્કતનું સરનામું : ફ્લેટ નં. ૨૦૨, સેક આર્ટસ એન્ડ ક્રિએટસ પ્રા.લિ.ની બાવુમાં	ન્ડ ફલોર, સુકન રેસીડે , કડોદરા બારડોલી રો		Net Profit / (Loss) for the			
	કિશનરાંદ્ર હક્ષમનદાર પોપરાની	¥3.96 स्ते. भी.	3 /- 99,00,000/-	3 /- 9,98,000/-	and the second of the	Extraordinary items)	
	મિલ્કતનું સરનાનું : ફલેટ નં. ૩૦૧, ભેન્ને માગ, સાંઇનાથ ફલેટ, વૃદાવન સોસાયઢી પાસે, વરાસીયા રોડ, વડોદરા – ૩૯૦૦૦દ્		ડોસીબો બૅક લિમિટેડ,	Total Comprehensive In for the period (after tax)			
	ફીરોગ્સા દિવાન	कीरोगशा हियान 3300,२९ २ई. कीर. ३ /- २३,८५,०००/- ३ /- २,३८,५००/-		ગાઉન્ડ કલોર, સ્ટાટ્રક બિલ્ડીંગ,	Equity Share Capital		
ડોદરા	બિલ્કતનું સરબામું : સી.એસ. નં. લ્લર અને લ્લ૩, કરાળા વિસ્તાર, રેકડી પાસે, ચરસ્વાણ નો ખોચો, પંચમકાલ				પાદરા રોડ, ચકલી સર્કલની પાસે, પેરીસ નગર, ઉરીપુરા, વડોદરા – 360008	Reserves (excluding Re	
	ગોદાવરી પ્લસ મીલ્સ મિલ્કતનું સરનામું : બ્લોક નં. ડી-૧૬૫,		3 /- 00,00,000/- 00, 900-4), 900, 000/-	1		Balance Sheet of the pr Earnings Per Share (of	
	শૌષે ષેતલપુર, બરોડા પ્રકાશકુમાર વિનોદલાલ દેસઈ	લપુર, બરોડા		- Unifer U.Sel	1.Basic :		
	ચિલ્કતનું સરનામું : ૪૦૧, શ્રીનાથજી પસ		18 . W. M. W.	2.Diluted :			
	asiter ,				the state of the state of	New Jerley Low	
વલસાડ	સિરાયજ્યાન મોહીનખાન પઠાણ દ્વર રહે. ફીટ. ફ /- ૮,૭૮,૪૦૦/- ફ /- ૮૭,૮૪૦/- મિલ્લન્યુ સરનાયું : ક્લેટ નં. બી-૨-૩૦૧, પરિવાર એપાર્ટમેન્ટ, સિલવાસા શેડ, ડૂંગરા, વાપી, બલસાડ - ૩૯૬૧૯૧				ડીસીબી બેંક શિમિટેડ, દીપ એપાર્ટમેન્ટ, સિલવાસ સેડ,	Note: The above is an extract of the SEBI (Listing Obligation	
	મોઢમ્મદ ખુતૂબુદ્દીન મોઢમ્મદ ધંસૂક	इथ० रहे. कीट.	इथ० स्त्रे. कीट. इ /- e,६०,५००/- १ /- s६,०५०/-		ુ ઝુ.આઇ.ડી.સી. ચાર રસ્તા, વર્ધમાન કોમ્પલેક્ષની પાસે, ઈમરાન નગર,	available on the Stock Exc www.rushil.com	
	भित्कतन् सरनाम् : इसेट ३०४, त्रीको भ	ाण, संधं लक्ति २, को	વાપી, ગુજરાત - ઉલ્દ્વલ્વ	a this of the			
200	1	Contraction of the second			La la participation de la	STATE GO. S.S. T	
ीहहार तेम २८-१२-१	નાર દ્વારા ઈચ્છૂક ખરીદદારો/બીડરો ની ઓકર ઉપરની મિલકત માટે બંધ ક હ ના ભપોરે ૪ વાગ્યા સુધીમાં કે તે અગ છા હશે તો તેમના છએમડી વ્યાજ વગ્હ	ઘરમાં અર્બેસ્ટ મની કિ ાઉ મોકલી શકે છે. બં	ચોઝીટ તરીકે કીસીબી ધ કવરો તારીખ. ૨૮–	બેંક લિ. ની તરફેર ૧૧-૧૯ ના રોજ સ	ટામાં ડિમાન્ડ ડ્રાફ્ટ સંલગ્ન બ્રાન્થમાં વારે ૧૧.૩૦ વાગે ખોલવામાં આવશે.	Place: Ahmedabad Date: 11 [®] November,2019	

JAI HIND - AHMEDABAD

0

ારઆંગા મિલકતા ના પ્રત્યાસ કબબા તા. ૦૭/૧૧/૨૦૧૯ ના રાજ લઇ લાધલ છ. રો, જામીનદારો, ગીરો કરનારાઓ અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ શપ્રકારના વ્યવહારો કરવા નહીં કે કરાવવા નહીં. જો કોઈ આ મિલકત સાથે વ્યવહારો ક્રરશે તો તે ધી કોસમોસ કો.ઓપ. બેંક લી., આશ્રમ રોડ, શાખાનો રકમ રૂા. ૮૪,૦૭,૭૯,૫૫૩,૧૯ કરોડ સાત લાખ ઓગણ્યાએસી હજાર પાંચસો ત્રેપન રૂપીયા ઓગણીસ પૈસા પૂરા.) તારીખ + વ્યાજ તથા અન્ય ખર્ચ વગેરે ના બોલાને આધીન રહેશે.

મિલકત નું વર્શન :

ાયલ કો.ઓપરેટીવ સોસાચટી લિ. ની ''સફલ પેગાસસ'' સ્ક્રીમ નાં ટાવર–બી ના પાંચમાં માળે પ૦૧ કે જેનો કુલ વિસ્તાર ૪૭૯૦ સ્ક્રે ફીટ છે. કે જે મોજે–વેજલપુર, તાલુકા–અમદાવાદ શન સબ–ડિસ્ટ્રીકટ–અમદાવાદ–૪ (પાલડી), ડિસ્ટ્રીકટ–અમદાવાદ, ફા.પ્લોટ નં.–૨૨,૨૩ સ્ક્રીમ નં. ૨૭ (રે.સ.નં. ૧૨૯૬/૧, ૧૨૯૬/૨ અને ૧૨૯૮/૧ ના અવેજમાં ફાળવેલી)જમીન પર ૬ મે. ગ્રાફ લેળોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ છે.

> અધિકૃત અધિકારી ધી કોસમોસ કો.ઓપ.બેંક લી.



and C

valuat

710/- e

RUSHIL DECOR LIMITED Regd. Office: S. No.125, Near Kalyanpura Patia, Vill. Itila,

Gandhinagar Mansa Road, Tal. Kalol, Dist. Gandhinagar -382845, Gujarat, India **Corporate Office:** Rushil House, Near Neelkanth Green Bungalow, Off. Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380058, Gujarat, India.


Ph.:+91-079-61400400 Fax :+91-079-61400401 E-mail : ipo@rushil.com Website : www.rushil.com CIN : L25209GJ1993PLC019532

ed Financial Results for the Quarter and Half Year ended 30th September, 2019

			(₹ in Lacs)
	Quarter ended 30.09.2019 (Unaudited)	Half Year ended 30.09.2019 (Unaudited)	Quarter ended 30.09.2018 (Unsudited)
	8942.97	17339.90	8918.70
xd (before Tax,Exceptional and/or	655.96	1357.65	509.98
od before Tax (after Exceptional and/or	655.96	1357.65	509.98
od after tax (after Exceptionel and/or	908.41	1508.42	319.74
for the period [Comprising Profit / (Loss) Other Comprehensive Income (after tax)]	908.05	1507.14	315.51
A CALIFIC IN PARA	1493.13	1493.13	1493.13
tion Reserve) as shown in the Audited syear	19099.04	19099.04	15594.11
each) (Not Annualised)		उम् तरजम	1945 10 19 10 19
O HAILENED DIG	6.08	. 10.10	2.15
- State and Calls	6.08	10.10	2.15

the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of ns and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are hange websites viz. www.bseindia.com and www.nseindia.com and also on the company's website

> For, Rushil Décor Limited Ghanshyambhai A. Thakkar Chairman DIN:00208843



Business Standard AHMEDABAD | TUESDAY, 12 NOVEMBER 2019

MANGALAM SEEDS LIMITED Regd Off.: 202, Sampada Complex, B/h. Tulsi Complex, Mithakhall Six Roads, Navrangpura, Ahmedabad-9. CIN: L01112GJ2011PLC067128

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations And Disclore Requirements) Regulations, 2018, that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, November 14, 2019 at Ahmedabad, interalia, to consider and approve (Standalone and Consolidated) unaudited Financial Results of the Company for the Quarter ended September 30, 2019. This information is also available on the website of the Company viz. www.mangalamseeds.com and the website of the Stock Exchange where the Company's shares are listed viz. BSE Limited (www.bseindia.com).

For Mangalam Seeds Limited Sd/- Rujavi Chalishajar Company Secretary and Compliance Officer

edena Bank : JHALOD BRANCH

FOR KIND ATTENTION OF OUR MOST VALUED CUSTOMERS In our endeavor to consolidate and strengthen our services to our customers, JHALOD Branch of erstwhile Dena Bank presently functioning at Near APMC, JHALOD will be shifted to Bank of Baroda, Gamadi Road, JHALOD and shall function at the said address w.e.f. 03.02.2020. It shall function and cater all types of banking business from the said premises.

We sincerely regret the inconvenience caused to you in this regard and assuring you of our best services at all times. Date : 12.11.2019 BRANCH HEAD Place : Jhalod eDENA BANK, JHALOD

THE COSMOS CO-OP. BANK LTD.

(Multistate Scheduled Bank)

Gujarat Regional Office : "Cosmos Bank Bhavan", Opp.Sales India, Income Tax Cross Road, Ashram Road, Ahmedabad - 380009. Ph : 079-27545693, 27545694

APPENDIX IV POSSESSION NOTICE (Under rule- 8(1)) (For Immovable Property)

Whereas;

Place : Ahmedabad

Date : 11.11.2019

The undersigned being the Authorized officer, of The Cosmos Co-op. Bank Ltd; under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice Dated 01-04-2016 calling upon Borrower M/S. GRAF LABORATORIES PVT. LTD. to repay the amount mentioned in the notice Rs. 84,07,79,553.19 (Rupees Eighty Four Crore Seven Lakh Seventy Nine Thousand Five Hundred Fifty Three & Nineteen Paisa Only) PLUS interest, charges, expenses etc. within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Mortgagor having failed to repay the amount and has shown willingness to handover possession of mortgaged property as detailed below. Accordingly the borrower/mortgagor has submitted his consent letter and handed over peaceful & vacant possession of mortgaged property to the undersigned. Notice is hereby given to the Borrower/Mortgagor and the public in general that the undersigned has taken physical possession of the property described herein below in exercise of powers conferred on him under sub section (4) of section 13 of said Act read with rule 8 of Security Interest Enforcement Rules, 2002, on Dt.07-11-2019.

The Borrower / Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of The Cosmos Co Op. Bank Ltd., Ashram Road Branch, for an amount of Rs. 84,07,79,553.19 as on Dt. 28/02/2016 interest charges, expenses etc. thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the immovable property

Property Belonging to M/S. GRAF LABORATORIES PVT. LTD.

All that immovable property bearing OFFICE NO. - 501, ADMEASURING 4790 SQ. FT. ON FIFTH FLOOR OF "SAFAL PEGASUS TOWER B" OF PEGASUS COMMERCIAL CO. OP. SOCIETY LTD. STANDING ON LAND BEARING FINAL PLOT NO. 22, 23 & 32 OF T. P. SCHEME NO. 27, (ALLOTTED IN LIEU OF REVENUE SURVEY NO. 1296/1, 1296/2 & 1298/1), SITUATED, LYING & BEING AT MOUJE : VEJALPUR, TALUKA : CITY, WITHIN THE REGISTRATION SUB DIST : AHMEDABAD 4 (PALDI) & DIST : AHMEDABAD.

Date : 07/11/2019

Place : Ahmedabad

Authorized Officer The Cosmos Co.op Bank Ltd.,

No.

	E
	CIN-
	Registered office: 1076, Dr. E. Moses Ro Website : www.oriconenterprises
EX	TRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL I
1	HI. Kennesi ci Kanarana kenara in
Sr. No.	Particulars
1	Total Income from Operations (Net)
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items and minority interest)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) the period (after tax) and Other Comprehensive Income (after tax)]
6	Equity Share Capital
7	Reserves (excluding Revaluation Reserves as shown in the Balance sheet of previous year)
8	Basic and Diluted Earnings Per Share(EPS) -before extraordinary iter (Face Value Rs. 02/- each)
7	Reserves (excluding Revaluation Reserves as shown in the Balance sheet of previous year)
8	Basic and Diluted Earnings Per Share(EPS) -before extraordinary iter (Face Value Rs. 02/- each)
W.	Key Standalone Financial Informati
Sr.	Particulars
No.	
1	Total Income from Operations (Net) Profit Before Tax
3	Net Profit After Tax
Note	
1	The above is an extract of the detailed format of Unaudited Standalone an Stock Exchange (s) under Regulation 33 of the SEBI (Listing Obligations Consolidated Einspiel Regulation are quellable on Stock Exchange
	Consolidated Financial Results are available on Stock Exchan (www.oriconenterprises.com).
	e : Mumbai
Date	: November 09, 2019
	077777
I	Manufacturer, Supplier & Exporter of
	EXTRACT OF UNAUDITE
	QUARTER AND HALF YEA
PT	
Sr.	

PARTICULARS

ORICON ENTERPRISES LTD.

- L28100MH1968PLC014156

s Road, Worli, Mumbai - 400018; E-mail Id : share@ocl-india.com, ses.com; Tel No.: 022-43226600; Fax No.: 022 24963055

L RESULTS FOR THE QUARTER/HALF YEAR ENDED SEPTEMBER 30, 2019

					(Rs. In Lakh	s, except EPS
		Quarter ended	1. 77	Half Yea	Year ended	
	30.09.2019 (Unaudited)	30.06.2019 (Unaudited)	30.09.2018 (Unaudited)	30.09.2019 (Unaudited)	30.09.2018 (Unaudited)	31.03.2019 (Audited)
	17919.35	34229.25	34655.39	52148.6	59380.36	111923.83
1 - 1 - 1	(964.05)	2139.48	1423.29	1175.43	1087.68	4942.68
Dr -	(964.05)	2639.48	1435.95	1675.43	1100.34	4942.68
	(376.99)	2356.04	630.85	1979.06	111.93	4033.44
oss) for	(572.70)	2023.26	550.25	1450.56	530.93	3760.89
1	3140.95	3140.95	3140.95	3140.95	3140.95	3140.95
ICe	1.1.1.1				- 11 11 - 	64752.23
item	(0.10)	1.44	0.59	1.35	0.38	2.31
- Capi	265		1.50		-110 1 1	64752.23
item	(0.10)	1.44	0.59	1.35	0.38	2.31

nation for the Quarter/ Half Year Ended September 30, 2019

"	9			1-11 11 1-	Jus n	(Rs. In Lakhs)
	Quarter ended			Half Year ended		Year ended
	30.09.2019	30.06.2019	30.09.2018	30.09.2019	30.09.2018	31.03.2019
	11087.44	25826.61	23565.61	36914.05	35677.11	63143.55
	413.59	2904.9	2399.17	3318.49	2408.13	4275.14
	644.91	2110.4	1787.07	2755.31	1781.78	3224.48

and Consolidated Financial Results for the Quarter / Half year ended September 30, 2019 filed with the ons and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Unaudited Standalone and nange(s) website (www.nseindia.com and www.bseindia.com) and on Company's website

> For Oricon Enterprises Limited Rajendra Somani Managing Director (DIN - 00332465)

5

